



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૫/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૬૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૭ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૩૫૬ લીટર દેશી દારૂ, ૧૨ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૧૧ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૧ મોટર સાયકલ અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૮ કેસ કરી ૪૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૯૮,૭૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૭૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૭૧/૧૯

વસ્ત્રાપુર: સરફરાજ એચુબ રિયાવાલા (ઉ.વ.૨૮) (રહે. રોકનપુરા આસ્ટોડીયા જમાલપુર) એ તા.૧૮/૫/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૨/૨૦૧૭ નારોજ થલતેજ એકોપોલીસ મોલ ટેક મહેન્દ્રા એક્ઝીક્યુટીવ જીઓ સેન્ટરમા ગ્રાઉંડ ફ્લોર ખાતે નોકરી કરતા અને પી.જી તરીકે રહેતા આરોપી સુશાંત શંકર અધિકારી (રહે. નં-૫૦૪ કામોટે ગામ-તાલમબોલી નોડે જીંદો તાલમબોલી રાઇગઢ, મહારાષ્ટ્ર) સરફરાજ રિયાવાલાનો વિશ્વાસ કેળવી તેમની પાસેથી રૂપિયા ૫૦,૦૦૦/- મેળવી લઈ બે દિવસમાં આપી દેવાનું કહી લઈ જઈ આજદીન સુધી પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એચ.રાવલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૮૭૨/૧૯

ચાંદખેડા: નરેન્દ્ર સ/ઓ શિવદયાલ લોધી (રહે. હરીઓમનગર વિભાગ-૧ મોટેરા ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૫/૧૯ બપોરના ૧૨/૦૦ થી તા.૧૯/૫/૧૯ કલાક ૧/૧૫ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.આર.દેસાઈ ચલાવે છે.

માધવપુરા: રાજેશભાઈ મોહનભાઈ પ્રજાપતી (રહે. રમણપુરાની ચાલી આનંદભુવન સામે દરીયાપુર દરવાજા બહાર) એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૫/૧૯ રાતના ૯/૩૦ થી તા.૧૯/૫/૧૯ કલાક ૬/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ ડુપ્લીકેટ ચાવીથી ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૪૮,૫૦૦/- અને રોકડ રૂપિયા ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૯,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

કાલુપુર: અબ્બાસ મુર્તમભાઈ રંગવાલા (રહે. મોટી મકેરીવાડ મહાલક્ષ્મી પેટ્રોલ પંપની બાજુમા રીલીફ રોડ કાલુપુર) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૫/૧૯ સાજના ૭/૧૫ વાગ્યાના સુમારે પોતાના મકાનના દરવાજાની સ્ટોપર ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના કિંમત રૂપિયા ૧૫,૫૦૦/-, પ્લાસ્ટીકના ડબ્બા કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૦,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.વી.પરમાર ચલાવે છે.

ખાડીયા: ભાવિક જીતેન્દ્રકુમાર સોની (રહે.નાગજી ભુદરની પોળ માંડવીની પોળ માણેકચોક ખાડીયા) એ ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૫/૧૯ સવારના ૧૦/૦૦ થી સાજના ૬/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દાદરાના દરવાજાનું તાળુ ડુપ્લીકેટ ચાવીથી ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૩૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.વી.રાઠવા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૮૭૩/૧૯

કારંજ: મોહંમદ શફી ગુલામ મયુદ્દીન શેખ (રહે. સીંધીવાડ ગાયકવાડ હવેલી જમાલપુર) એ કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૫/૧૯ સાજના ૭/૪૫ થી રાતના ૮/૦૦ વાગ્યા દરમ્યાન આરોપી મોહંમદ આઝમ ઇકબાલભાઈ પાયડીયા (રહે. ગંજીપુરી ગવાડી ડીસા બનાસકાંઠા) કારંજ લાલદરવાજા બિસ્મીલ્લા લોડીંગ ગેસ્ટ હાઉસના રિસેપ્શનના ટેબલના ડ્રોઅરમાંથી રોકડ રૂપિયા ૧,૨૦,૦૦૦/- ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.જે.ચાવડા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૭૪/૧૯

રાણીપ: ભરતભાઈ ભીખાભાઈ પટેલ (ઉ.વ.૪૯) (રહે. બાલારામ સોસાયટી ગાયત્રી મંદીર રોડ રાણીપ) એ અગમ્ય કારણસર તા.૧૯/૫/૧૯ કલાક ૧/૩૦ થી ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી વી.આર.ચાવડા ચલાવે છે.

કૃષ્ણનગર: અમરતભાઈ જેઠાભાઈ ચારણ (ઉ.વ.૪૫) (રહે. હનુમાનગલી રામદેવ સોસાયટી ઠક્કરનગર) એ અગમ્ય કારણસર તા.૧૮/૫/૧૯ કલાક ૧૧/૦૦ થી તા.૧૯/૫/૧૯ સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે બારીમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી કે.ડી.પટેલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.